



પ્રેસનોટ-૦૧

તા. ૨૨.૦૮.૨૦૧૮

જેઓ એકબીજાના મોઢા જોવા તૈયાર નથી તેવા લોકો ગઠબંધન કરી રહ્યા છે. આ “ગઠબંધન” નહીં પરંતુ “ઠગબંધન” છે.

- શ્રી જીતુભાઈ વાઘાણી

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વબળ અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના સંગઠનબળ અને ભાજપાના લાખો કાર્યકર્તાના પરિશ્રમની તોલે કોઈ આવી શકે નહીં - શ્રી જીતુભાઈ વાઘાણી

૨૦૧૮માં લોકહૃદયસમ્રાટ શ્રી નરેન્દ્રભાઈ મોદી પુનઃ વડાપ્રધાન બનશે અને ગુજરાતમાં સંસદની ૨૬માંથી ૨૬ બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય નિશ્ચિત છે - શ્રી જીતુભાઈ વાઘાણી

કોંગ્રેસને જેટલા ગપગોળા ચલાવવા હોય તે ચલાવે, જેટલી કુટનીતિ અપનાવવી હોય તે અપનાવે, સેવા કાર્યોનું ભાથું અને જનતા જનાર્દન આશીર્વાદ ભાજપા સાથે જ છે - શ્રી જીતુભાઈ વાઘાણી

ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી આઈ.કે.જડેજાએ જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં એક દિવસીય પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ. જેમાં પ્રદેશ પ્રભારીશ્રી અને રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ભુપેન્દ્રજી યાદવ, માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ત્રણ તબક્કામાં કામગીરી બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ કારોબારીમાં ઉપસ્થિત આગેવાનોને આવકારતા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, દેશમાં જેઓ એકબીજાના મોઢા જોવા તૈયાર નથી તેવા લોકો ગઠબંધન કરી રહ્યા છે. આ “ગઠબંધન” નહીં પરંતુ “ઠગબંધન” છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વબળ અને આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના સંગઠનબળની તોલે કોઈ આવી શકે નહીં. બાંગ્લાદેશના ઘુષણખોરો હોય કે રોહિંગીયા મુસલમાનો હોય તમામ બાબતે ભાજપાની નીતિ સ્પષ્ટ છે. ઘુષણખોરોનું આ દેશમાં કોઈ સ્થાન નથી. આ દેશના સંસાધનો પર દેશની જનતાનો જ હક છે.

શ્રી જીતુભાઈ વાઘાણીએ કેન્દ્ર સરકારની વિવિધ પ્રજ્ઞલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આયુષ્યમાન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જનધન યોજના, સ્ટાર્ટ અપ, સ્ટેન્ડ અપ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજલા યોજના સહિતની કેન્દ્રની સવાસો કરતા વધુ યોજનાને કારણે દેશની જનતાને ખુબ મોટો લાભ થયો છે. વીમા કંપની જેનો વીમો લેવાની ના પાડે તેવા લોકોને પણ આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચ આપવાનું કામ કરીને કેન્દ્ર સરકારે સાચા અર્થમાં લોકસેવાનું કામ કર્યું છે. ખેડુતોની આવક આવનારા સમયમાં ડબલ થાય તે દિશામાં કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. ખેડુતો માટે પ્રથમ વખત લઘુત્તમ ટેકાના ભાવ ભાજપાના શાસનમાં જાહેર થયા છે.

શ્રી જીતુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આદરણીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં અનેક પ્રજ્ઞલક્ષી યોજનાઓ ચાલી રહી છે. મહિલા સુરક્ષા માટે ૧૮૧ અભયમ્ યોજના, વિધવા પેન્શનમાં વધારો, વિના મુલ્યે ઉચ્ચ શિક્ષણ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનું તાત્કાલિક નિદાન સહિતની અનેક મહિલા હિતની યોજના અમલમાં મુકી છે. ખેડુતોને ટેકા મહત્તમ ભાવ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે. યુવાનોને રોજગારી મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. નવી જીઆઈડીસીની યોજના પણ હાલમાં જાહેર થઈ છે. આમ, તમામ જાતિ-વર્ગ-સંપ્રદાયથી ઉપર ઉઠીને સૌના સાથ સૌના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે ત્યારે,

ભારતીય જનતા પાર્ટી

ગુજરાત પ્રદેશ

શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

..૨..

વર્ષ ૨૦૧૮માં પણ ૨૬માંથી ૨૬ બેઠક જીતતા ભાજપાને કોઈ અટકાવી શકશે નહીં. કોંગ્રેસને જેટલા ગપગોળા ચલાવવા હોય તે ચલાવે, જેટલી કુટનીતિ અપનાવવી હોય તે અપનાવે, સેવા કાર્યોનું ભાથું અને જનતા જનાર્દન આશીર્વાદ ભાજપા સાથે જ છે

આજની પ્રદેશ કારોબારીના પ્રથમ તબક્કામાં સમગ્ર દેશના પ્રિય એવા ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય શ્રી અટલજીની શોકાંજલી માટેનો શોક પ્રસ્તાવ રાજ્ય સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહજી યુડાસમા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ શોકપ્રસ્તાવ બાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ બે મીનીટનું મૌન પાળીને શ્રદ્ધેય શ્રી અટલજીને શ્રદ્ધાંજલી અર્પી હતી.

શોક પ્રસ્તાવ બાદ પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો હતો. રાજકીય પ્રસ્તાવમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે નેતૃત્વ નથી, નિયત નથી અને નેતા પણ નથી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની બાલીસતાના કારણે સવાસો વર્ષ જુની કોંગ્રેસ આજે હતાશ-નિરાશ-નેતૃત્વવિહીન અને મુદ્દાવિહીન થઈ ગઈ છે. દેશની જનતાને કોંગ્રેસ પર ભરોસો નથી. એટલું જ નહીં કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ કોંગ્રેસ પર ભરોસો નથી. જ્યારે બીજી તરફ આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વને સમગ્ર દેશ અને દુનિયામાં સ્વીકૃતિ મળી છે. વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપાની સરકાર રચાયા બાદ છેલ્લા ચાર વર્ષમાં ૧૮ રાજ્યોમાં ભાજપાની સરકાર રચાઈ છે. તે જ પુરવાર કરે છે કે, નરેન્દ્રભાઈના વિકાસના સુત્રને સમગ્ર દેશના લોકોએ વધાવી લીધું છે. શ્રી શંકરભાઈ ચૌધરીએ રજૂ કરેલા પ્રસ્તાવને પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહજી પરમારે સમર્થન આપતા જણાવ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપાનો વિકાસ થયો છે, દેશનો વિકાસ થયો છે. સમગ્ર દુનિયામાં ભારતનું વજન વધ્યું છે. ત્યારે વર્ષ ૨૦૧૪ કરતા પણ વધુ વિશ્વાસથી વર્ષ ૨૦૧૮ની લોકસભા ચૂંટણી માટે લોકો નરેન્દ્રભાઈ સાથે જોડાઈ રહ્યા છે.

રાજકીય પ્રસ્તાવ બાદ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારને અભિનંદન આપનો પ્રસ્તાવ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે.જડેજાએ રજૂ કર્યો હતો. જેમાં શ્રી જડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતના સપુત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચાર વર્ષના શાસનમાં ગરીબ અને મધ્યમ વર્ગની વ્યક્તિઓને સીધા જ લાભો પ્રાપ્ત થાય, છેવાડાના માનવીનો સર્વાંગી વિકાસ થાય અને દેશનો કિસાન વધુ સમૃદ્ધ બને તે માટેની અનેકવિધ યોજનાઓ સાથે સુશાસન આપેલ છે. કેન્દ્ર સરકારની નીતિ વિષયક નિર્ણાયકતા અને પારદર્શી શાસનવ્યવસ્થાને લીધે આજે ભારતીય અર્થતંત્ર વિશ્વનું સૌથી મોટું છઠ્ઠા નંબરનું અર્થતંત્ર બન્યું છે. તમામ ક્ષેત્રે ભારત પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈની કુનેહ નીતિ અને સંગઠનના સફળ માર્ગદર્શન દ્વારા ભાજપા સરકારને સતત છઠ્ઠી વખત પસંદ કરીને સાડા છ કરોડ ગુજરાતીઓએ વિકાસ ઉન્મુખ અભિગમ અને અવિરત વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરેલ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના સંવેદનશીલ અભિગમ, પારદર્શક શાસન, નિર્ણાયક પરિશ્રમ અને પ્રગતિશીલતાની પ્રતિબદ્ધતાને વરેલી સરકારે રાજ્યમાં વિકાસની તેજ ગતિ દ્વારા વિકાસ કાર્યોને જનજન સુધી પહોચાડવાનું કાર્ય કર્યું છે. કેન્દ્ર અને ગુજરાતની ભાજપા સરકારોએ પ્રજલક્ષી વિકાસકાર્યોની હારમાળા રચેલ છે ત્યારે “અજેય ભારત અટલ ભાજપ”ના મંત્ર સાથે લોકસભાની ચૂંટણીમાં તમામ સીટો પર ભાજપા વિજયી બને તે માટે જનજન સુધી અને ઘરઘર સુધી સરકારના વિકાસના મીઠા ફળો પહોચાડવાની નેમ સાથે આજની કારોબારી ગુજરાત અને કેન્દ્રની બંને સરકારોને અભિનંદન પાઠવે છે. શ્રી જડેજાએ રજૂ કરેલા પ્રસ્તાવને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી રમીલાબેન બારાએ સમર્થન આપ્યું હતું.

પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાએ સંગઠનલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત ભાજપા સંગઠન દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમોની સમીક્ષા તેમજ ૨૦૧૮ની ચૂંટણીને ધ્યાનમાં રાખી આગામી સમયની કાર્યયોજનાઓ વિશે માહિતી આપી હતી. કાર્યાંજલી કાર્યક્રમ અંતર્ગત આગામી ૨૫ સપ્ટેમ્બર સુધી મેડીકલ કેમ્પ, ૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવાના સંકલ્પ સાથે જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છતા કાર્યક્રમો, વિસ્તારક યોજના, સદસ્યતા વૃદ્ધિ અભિયાન, કિસાન વિસ્તારક યોજના જેવા આગામી કાર્યક્રમો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

(ડૉ. હર્ષદ પટેલ)

પ્રદેશ કન્વીનર, મીડીયા વિભાગ



પ્રેસનોટ-૦૨

તા. ૨૨.૦૮.૨૦૧૮

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ૩૧ ઓક્ટોબરના રોજ થનાર છે - શ્રી વિજયભાઈ રૂપાણી

નવેમ્બર ૨૦૧૩માં સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે દેશના વિવિધ રાજ્યોમાંથી ખેડુતોના ઓજરસમા લોખંડમાંથી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી વિરાટ પ્રતિમાને આખરી ઓપ અપાઈ રહ્યો છે

૨૦ ઓક્ટોબર થી ૨૯ ઓક્ટોબર દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૧૦,૦૦૦ થી વધુ ગામડાઓમાં શ્રી સરદાર પટેલના સ્ટેચ્યુની પ્રતિકૃતિ સાથે રથ જશે.

૧ ડિસેમ્બર થી ૩૦ ડિસેમ્બર દરમ્યાન રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ અને રાજ્યના પ્રતિનિધિ મંડળ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત કરી સરદાર સાહેબને શ્રધ્ધાંજલી અર્પણ કરશે

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે આજરોજ ભાજપાની પ્રદેશ કારોબારી મળી હતી. પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં મળેલ આજની આ કારોબારીમાં રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારીશ્રી ભુપેન્દ્રજી યાદવ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશના આગેવાનશ્રીઓ, પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓ તેમજ સંગઠનના વિવિધ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિની વિશદ્ માહિતીથી કારોબારીને માહિતગાર કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સ્ટેચ્યુ ઓફ યુનિટિની કલ્પના સરદાર સાહેબની “એક ભારત શ્રેષ્ઠ ભારત, અતૂટ ભારત, સંગઠીત ભારતની દિર્ઘદ્રષ્ટિને એક સ્ટેચ્યુ ઓફ યુનિટિને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ ગુજરાતના ગૌરવ પનોતા પુત્ર લોકનાયક જનહદયસમ્રાટ પ્રધાનસેવક એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ૩૧ ઓક્ટોબરના રોજ વિશ્વ સમક્ષ થનાર છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજરોજ પ્રદેશ કારોબારીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિની માહિતી આપી હતી, જે નીચે મુજબ છે.

- નવેમ્બર ૨૦૧૩માં રાજ્યના મંત્રીશ્રીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે દેશના વિવિધ રાજ્યોમાંથી ખેડુતોના ઓજરસમા લોખંડ એકત્રિત કરવામાં આવ્યું હતું. જેમાંથી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી વિરાટ પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
- ૨૦ ઓક્ટોબર થી ૨૯ ઓક્ટોબર દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૧૦,૦૦૦ થી વધુ ગામડાઓમાં શ્રી સરદાર પટેલના સ્ટેચ્યુની પ્રતિકૃતિ સ્વરૂપે રથમાં જશે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ અને સરદાર પટેલની ફિલ્મ બતાવવામાં આવશે.
- ૩૧ ઓક્ટોબરના દિવસે સમગ્ર દેશના દેશવાસીઓ સરદાર સાહેબને સાચી શ્રધ્ધાંજલી આપશે અને પ્રતિમાનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે કરવામાં આવશે.
- સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિસરમાં વેલી ઓફ ફ્લાવર, રોપ-વે, અન્ય રાજ્યોના ભવન, ટ્રાયબલ મ્યુજીયમ તેમજ સ્થાનિક આદિવાસી યુવાનોને ગાઈડની કામગીરીની તાલીમ આપવામાં આવશે.
- ૫ નવેમ્બર થી ૧૫ નવેમ્બર દરમ્યાન દેશના વિવિધ રાજ્યોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિની માહિતી અને પ્રતિમા નિરિક્ષણ માટે નિમંત્રણ આપવામાં આવશે.
- ૧ ડિસેમ્બર થી ૩૦ ડિસેમ્બર દરમ્યાન વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ અને રાજ્યનું પ્રતિનિધિ મંડળ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત કરી સરદાર સાહેબને શ્રધ્ધાંજલી અર્પણ કરશે.

(ડૉ. હર્ષદ પટેલ)

પ્રદેશ કન્વીનર, મીડીયા વિભાગ



પ્રેસનોટ-૦૩

તા. ૨૨.૦૮.૨૦૧૮

**વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાંચી, ઝારખંડ ખાતેથી આરોગ્યલક્ષી વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્માન ભારત
- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PM-JAY નો દેશવ્યાપી શુભારંભ કરાવશે. - શ્રી નીતિન પટેલ**

**મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે સીવીલ હોસ્પિટલ અસારવા, અમદાવાદ ખાતે આયુષ્મા ભારત - પ્રધાનમંત્રી જન
આરોગ્ય યોજનાનું ઉદ્ઘાટન કરાવશે. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લામાં આવતીકાલે યોજનાનું ઉદ્ઘાટન કરાશે. - શ્રી નીતિન પટેલ**

ગુજરાતના ૪૪ લાખ ૮૫ હજાર પરિવારોના ૨.૩૨ કરોડ નાગરિકોને આ યોજનાના સીધા લાભો મળશે. - શ્રી નીતિન પટેલ

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે યોજાયેલ આજની કારોબારીમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PM-JAY વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રહેતા પોતાના મુખ્યમંત્રીકાળ દરમ્યાન પ્રજાના દરેક વર્ગને સ્પર્ષે તેવી અનેકવિધ યોજનાઓનું અમલીકરણ હાથ ધર્યું હતું. ટુંકાગાળા, મધ્યમગાળા અને લાંબા ગાળાની યોજનાઓ થકી લાખો-કરોડો લાભાર્થીઓને લાભો મળતા હોય છે. તેવી અગત્યની ક્લેગશીપ યોજનાઓ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં અમલ કરી રહી અને તેવી જ રીતે અત્યારે દેશભરમાં અમલ કરી રહ્યા છે. પ્રજાના હૃદયને આ યોજનાઓ પ્રેમથી સ્પર્ષી રહે છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાંચી - ઝારખંડ ખાતેથી આરોગ્યલક્ષી વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PM-JAY નો દેશવ્યાપી શુભારંભ કરાવશે અને રાજ્યકક્ષાનો શુભારંભ કાર્યક્રમ આવતીકાલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદૂહસ્તે સીવીલ હોસ્પિટલ અસારવા, અમદાવાદ ખાતે યોજાશે. યુપીએના શાસન દરમ્યાન ૨૦૧૧માં આખા દેશમાં આર્થિક-સામાજિક સર્વે કરવામાં આવ્યો હતો. યુપીએ સરકારે તે સર્વેનો કોઈ જ ઉપયોગ કર્યો ન હતો. માત્રને માત્ર એ રેકર્ડ પર જ રહ્યો હતો. તે સર્વેના આધારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આ યોજના અંતર્ગત લાભાર્થીઓની પસંદગી કરી છે. ગુજરાત રાજ્યમાં ૪૪ લાખ ૮૫ હજાર પરિવારોને એટલે કે, ૨.૩૨ કરોડ નાગરિકોને આ યોજનાનો સીધો લાભ મળવાનો છે. ગુજરાતમાં સરકારી અને ખાનગી તેમ મળીને કુલ ૧૭૦૦ હોસ્પિટલો મારફતે આ યોજનાનો લાભ લાભાર્થીઓને મળશે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત નાની થી લઈને બધી જ મોટી બીમારીઓને આવરી લેવામાં આવશે. નાનામાં નાના હળવા રોગોની સારવાર પણ તેમાં આવરી લેવામાં આવ્યા છે. આ યોજના કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ભાગીદારીવાળી યોજના છે. તેમાં ૬૦ ટકાનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે અને ૪૦ ટકાનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ યોજના અંતર્ગત બે વિભાગ પાડવામાં આવ્યા છે. ૫૦ હજાર રૂપિયાથી નીચેની સારવાર એ વીમા કંપનીઓ થકી ચૂકવાણી કરવામાં આવશે અને ૫૦ હજારથી વધુ ખર્ચવાળી સારવારની ચૂકવાણી મા વાન્સલ્યની જેમ જ રાજ્ય સરકાર દ્વારા ચકાસણી કરીને ચૂકવાણી કરવામાં આવશે. ગુજરાતની રાજ્ય સરકારે વહિવટી પ્રક્રિયા પૂર્ણ કરી દીધેલ છે. દેશ તેમજ રાજ્યના લાભાર્થીઓને વડાપ્રધાનશ્રીના સંદેશવાળો પત્ર મળશે અને તે પત્રમાં જોડાયેલ સ્વીપના આધારે આધારકાર્ડ દ્વારા લાભાર્થી તરીકેની માન્યતા આપવામાં આવશે. રજીસ્ટર્ડ થયેલ હોસ્પિટલોમાં આરોગ્ય મિત્ર તરીકે સહાયકની નિમાણુંક કરવામાં આવશે જેઓ આ યોજનાનું સંપૂર્ણ માર્ગદર્શન આપશે. માનવસેવાની મોટામાં મોટી કામગીરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કરવા જઈ રહ્યા છે ત્યારે સરકાર તેમજ સંગઠન સાથે જોડાઈને આ યોજનાનો વધુમાં વધુ લાભ લાભાર્થીઓને અપાવી શકીએ તે માટે કાર્યરત થવાની અપીલ નાયબ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

(ડૉ. હર્ષદ પટેલ)

પ્રદેશ કન્વીનર, મીડીયા વિભાગ